

This note can be read out loud: This form needs to be filled out after discussions at the village level and internal discussions. Only one form per village should be submitted.	આ નોંધ મોટેથી વાંચી શકાય છે: આ ફોર્મ ગ્રામ્ય સ્તરે ચર્ચાઓ અને આંતરિક ચર્ચાઓ પછી ભરવાનું છે. ગામ દીઠ માત્ર એક જ ફોર્મ સબમિટ કરવાનું રહેશે.	
Block	તાલુકો	
Village	વાલિયા	
How many of the following types of private lands within the village are available for tree plantation? (Please select all that apply)	ગામની અંદર નીચેનામાંથી કેટલી ખાનગી જમીનો વૃક્ષારોપણ માટે ઉપલબ્ધ છે? (ફૂપા કરીને લાગુ પડતા તમામને પસંદ કરો)	
Agricultural land Section	કૃષિ જમીન અંગેનાં પ્રશ્નો	
Agri land	ખેતીની જમીન	
What is the approximate size of agricultural land (in acres) available for tree plantation in the village?	ગામમાં વૃક્ષારોપણ માટે ખેતીની જમીન (એકરમાં)ની અંદાજિત સાઈઝ (માપ) કેટલી છે?	
In which hamlets or areas are these agricultural lands located?	આ ખેતીની જમીનો કયા ગામો અથવા વિસ્તારોમાં આવેલી છે?	
What is the estimated number of trees that can be planted on agricultural land in the village?	ગામમાં ખેતીની જમીન પર વાવેતર કરી શકાય તેવા વૃક્ષોની અંદાજિત સંખ્યા કેટલી છે?	
What water sources are accessible for watering saplings on agricultural land? (Please select all applicable)	ખેતીની જમીન પરના છોડને પાણી આપવા માટે કયા જળ સ્ત્રોતો ઉપલબ્ધ છે? (ફૂપા કરીને તમામ લાગુ પડતાં વિકલ્પો પસંદ કરો)	
How many months of the year is water available in the agricultural lands to irrigate the saplings?	ખેતીની જમીનમાં રોપાઓને સિંચાઈ માટે વર્ષના કેટલા મહિના પાણી મળે છે?	
During the summer months, is water availability sufficient to safeguard the saplings that will be planted in agricultural land?	ઉનાળાના મહિનાઓ દરમિયાન, શું ખેતીની જમીનમાં રોપવામાં આવનાર રોપાઓની સુરક્ષા માટે પાણીની ઉપલબ્ધતા પૂરતી છે?	

Who is responsible for the care and maintenance of saplings planted on agricultural lands?	ખેતીની જમીન પર વાવેલા રોપાઓની સંભાળ અને જાળવણી માટે કોણ જવાબદાર છે?	
What types of plant saplings are suitable for planting in agricultural land? (Please select all that apply)	ખેતીની જમીનમાં રોપવા માટે કયા પ્રકારના છોડના રોપા યોગ્ય છે? (કૃપા કરીને લાગુ પડતા તમામ વિકલ્પોને પસંદ કરો)	
Please select all the names of the plants that can be planted in agricultural land.	કૃપા કરીને ખેતીની જમીનમાં વાવેતર કરી શકાય તેવા તમામ છોડના નામ પસંદ કરો.	
What safety measures do you believe are necessary for tree saplings?	તમે શું માનો છો કે વૃક્ષના રોપાઓ માટે સલામતીના કયા પગલાં જરૂરી છે?	
Private fallow land or non-cultivable land section	ખાનગી પડતર જમીન અથવા બિન ખેતીલાયક જમીન અંગેનાં પ્રશ્નો	
Private fallow land or non-cultivable land section	ખાનગી પડતર જમીન અથવા બિન ખેતીલાયક જમીન અંગેનાં પ્રશ્નો	
What is the approximate size of Private fallow land or non-cultivable land (in acres) available for tree plantation in the village?	ગામમાં વૃક્ષારોપણ માટે ખાનગી પડતર જમીન અથવા બિનખેતીની જમીન (એકરમાં)ની અંદાજિત સાઈઝ (માપ) કેટલી છે?	
In which hamlets or areas are these Private fallow land or non-cultivable lands located?	આ ખાનગી પડતર જમીન અથવા બિનખેતીની જમીનો કયા ગામો અથવા વિસ્તારોમાં આવેલી છે?	
What is the estimated number of trees that can be planted on Private fallow land or non-cultivable land in the village?	ગામમાં ખાનગી પડતર જમીન અથવા બિનખેતી લાયક જમીન પર વાવેતર કરી શકાય તેવા વૃક્ષોની અંદાજિત સંખ્યા કેટલી છે?	
What water sources are accessible for watering saplings on Private fallow land or non-cultivable land? (Please select all applicable)	ખાનગી પડતર જમીન અથવા બિનખેતીની જમીન પર રોપાઓને પાણી આપવા માટે કયા પાણીના સ્ત્રોતો ઉપલબ્ધ છે? (કૃપા કરીને તમામ લાગુ પડતાં વિકલ્પો પસંદ કરો)	

How many months of the year is water available in the Private fallow land or non-cultivable land to irrigate the saplings?	ખાનગી પડતર જમીન અથવા બિનખેતીની જમીનમાં છોડને સિંચાઈ કરવા માટે વર્ષમાં કેટલા મહિના પાણી ઉપલબ્ધ હોય છે?	
During the summer months, is water availability sufficient to safeguard the saplings that will be planted in Private fallow land or non-cultivable land?	ઉનાળાના મહિનાઓ દરમિયાન, શું ખાનગી પડતર જમીન અથવા બિનખેતી લાયક જમીનમાં રોપવામાં આવનાર રોપાઓની સુરક્ષા માટે પાણીની ઉપલબ્ધતા પૂરતી છે?	
Who is responsible for the care and maintenance of saplings planted on Private fallow land or non-cultivable land?	ખાનગી પડતર જમીન અથવા બિનખેતીની જમીન પર વાવેલા રોપાઓની સંભાળ અને જાળવણી માટે કોણ જવાબદાર છે?	
What types of plant saplings are suitable for planting in Private fallow land or non-cultivable land? (Please select all that apply)	ખાનગી પડતર જમીન અથવા બિનખેતી લાયક જમીનમાં વાવેતર માટે કયા પ્રકારના છોડના રોપા યોગ્ય છે? (ફૂપા કરીને લાગુ પડતા તમામને પસંદ કરો)	
Please select all the names of the plants that can be planted in Private fallow land or non-cultivable land.	ફૂપા કરીને ખાનગી પડતર જમીન અથવા બિનખેતી લાયક જમીનમાં વાવેતર કરી શકાય તેવા તમામ છોડના નામ પસંદ કરો.	
What safety measures do you believe are necessary for tree saplings?	તમે શું માનો છો કે વૃક્ષના રોપાઓ માટે સલામતીના કયા પગલાં જરૂરી છે?	
Land around the house section	ઘરની આસપાસની જમીન અંગેનાં પ્રશ્નો	
Land around the house	ઘરની આસપાસની જમીન	
What is the approximate size of Land around the houses (in acres) available for tree plantation in the village?	ગામમાં વૃક્ષારોપણ માટે ઉપલબ્ધ ઘરોની આસપાસ (એકરમાં) જમીનની અંદાજિત સાઈઝ (માપ) કેટલી છે?	
In which hamlets or areas are these lands around the houses located?	ઘરોની આસપાસની આ જમીનો કયા ગામો અથવા વિસ્તારોમાં આવેલી છે?	

What is the estimated number of trees that can be planted on Land around the houses in the village?	ગામમાં ઘરોની આસપાસની જમીન પર વાવેતર કરી શકાય તેવા વૃક્ષોની અંદાજિત સંખ્યા કેટલી છે?	
What water sources are accessible for watering saplings on Land around the houses? (Please select all applicable)	ઘરોની આસપાસની જમીન પરના છોડને પાણી આપવા માટે કયા પાણીના સ્ત્રોતો ઉપલબ્ધ છે? (ફૂપા કરીને તમામ લાગુ પડતાં વિકલ્પો પસંદ કરો)	
How many months of the year is water available in the Land around the house to irrigate the saplings?	ઘરની આજુબાજુની જમીનમાં રોપાઓને સિંચાઈ કરવા માટે વર્ષના કેટલા મહિના પાણી ઉપલબ્ધ હોય છે?	
During the summer months, is water availability sufficient to safeguard the saplings that will be planted in Land around the house?	ઉનાળાના મહિનાઓ દરમિયાન, ઘરની આસપાસની જમીનમાં રોપવામાં આવનાર રોપાઓને સુરક્ષિત રાખવા માટે પાણીની ઉપલબ્ધતા પૂરતી છે?	
Who is responsible for the care and maintenance of saplings planted on Land around the house?	ઘરની આસપાસની જમીન પર વાવેલા રોપાઓની સંભાળ અને જાળવણી માટે કોણ જવાબદાર છે?	
What types of plant saplings are suitable for planting in Land around the house? (Please select all that apply)	ઘરની આસપાસની જમીનમાં રોપવા માટે કયા પ્રકારના છોડના રોપા યોગ્ય છે? (ફૂપા કરીને લાગુ પડતા તમામ વિકલ્પો પસંદ કરો)	
Please select all the names of the plants that can be planted in Land around the house	ફૂપા કરીને ઘરની આસપાસની જમીનમાં વાવેતર કરી શકાય તેવા તમામ છોડના નામ પસંદ કરો	
What safety measures do you believe are necessary for tree saplings?	તમે શું માનો છો કે વૃક્ષના રોપાઓ માટે સલામતીના કયા પગલાં જરૂરી છે?	
How many of the following types of public lands within the village are available for tree plantation? (Please select all that apply)	ગામની અંદર નીચેનામાંથી કેટલી પ્રકારની જાહેર જમીનો વૃક્ષારોપણ માટે ઉપલબ્ધ છે? (ફૂપા કરીને લાગુ પડતા તમામ વિકલ્પો પસંદ કરો)	
Other public land	અન્ય જાહેર જમીન	
Waste land - Section	નકામાં/પડતર જમીન અંગેનાં પ્રશ્નો	

What is the approximate size of Waste land (in acres) available for tree plantation in the village?	ગામમાં વૃક્ષારોપણ માટે ઉપલબ્ધ નકામી/પડતર જમીન (એકરમાં)ની અંદાજિત સાઈઝ (માપ) કેટલી છે?	
In which hamlets or areas are these Waste land located?	આ નકામી/પડતર જમીન કયા ગામો અથવા વિસ્તારોમાં આવેલી છે?	
What is the estimated number of trees that can be planted on Waste land in the village?	ગામની નકામી/પડતર જમીન પર વાવી શકાય તેવા વૃક્ષોની અંદાજિત સંખ્યા કેટલી છે?	
What water sources are accessible for watering saplings on Waste land ? (Please select all applicable)	નકામી/ પડતર જમીન પર છોડને પાણી આપવા માટે કયા પાણીના સ્ત્રોતો ઉપલબ્ધ છે? (ફૂપા કરીને તમામ લાગુ પડતાં વિકલ્પો પસંદ કરો)	
How many months of the year is water available in the Waste land to irrigate the saplings?	રોપાઓની સિંચાઈ કરવા માટે નકામી/ પડતર જમીનમાં વર્ષના કેટલા મહિના પાણી ઉપલબ્ધ હોય છે?	
During the summer months, is water availability sufficient to safeguard the saplings that will be planted in Waste land ?	ઉનાળાના મહિનાઓ દરમિયાન, શું પાણીની ઉપલબ્ધતા નકામી/ પડતર જમીનમાં રોપવામાં આવનાર રોપાઓની સુરક્ષા માટે પૂરતી છે?	
Who is responsible for the care and maintenance of saplings planted on Waste land ?	નકામી/પડતર જમીન પર વાવેલા રોપાઓની સંભાળ અને જાળવણી માટે કોણ જવાબદાર છે?	
What types of plant saplings are suitable for planting in Waste land ? (Please select all that apply)	નકામી/પડતર જમીનમાં રોપવા માટે કયા પ્રકારના છોડના રોપા યોગ્ય છે? (ફૂપા કરીને લાગુ પડતા તમામને પસંદ કરો)	
Please select all the names of the plants that can be planted in Waste land .	ફૂપા કરીને નકામી/પડતર જમીનમાં વાવેતર કરી શકાય તેવા તમામ છોડના નામ પસંદ કરો.	
What safety measures do you believe are necessary for tree saplings?	તમે શું માનો છો કે વૃક્ષના રોપાઓ માટે સલામતીના કયા પગલાં જરૂરી છે?	
Goucher land - Section	ગૌચર જમીન અંગેના પ્રશ્નો	
What is the approximate size of Goucher land (in acres) available for tree plantation in the village?	ગામમાં વૃક્ષારોપણ માટે ગૌચર જમીન (એકરમાં)ની અંદાજિત સાઈઝ (માપ) કેટલી છે?	

In which hamlets or areas are these Goucher land located?	આ ગૌચર જમીન કયા ગામો અથવા વિસ્તારોમાં આવેલી છે?	
What is the estimated number of trees that can be planted on Goucher land in the village?	ગામની ગૌચર જમીન પર વાલી શકાય તેવા વૃક્ષોની અંદાજિત સંખ્યા કેટલી છે?	
What water sources are accessible for watering saplings on Goucher land ? (Please select all applicable)	ગૌચર જમીન પરના છોડને પાણી આપવા માટે કયા પાણીના સ્ત્રોતો ઉપલબ્ધ છે? (કૃપા કરીને તમામ લાગુ પસંદ કરો)	
How many months of the year is water available in the Goucher land to irrigate the saplings?	ગૌચરની જમીનમાં વર્ષના કેટલા મહિના રોપાઓને સિંચાઈ માટે પાણી મળે છે?	
During the summer months, is water availability sufficient to safeguard the saplings that will be planted in Goucher land ?	ઉનાળાના મહિનાઓ દરમિયાન, શું ગૌચર જમીનમાં રોપવામાં આવનાર રોપાઓની સુરક્ષા માટે પાણીની ઉપલબ્ધતા પૂરતી છે?	
Who is responsible for the care and maintenance of saplings planted on Goucher land ?	ગૌચર જમીન પર વાલેલા રોપાઓની સંભાળ અને જાળવણી માટે કોણ જવાબદાર છે?	
What types of plant saplings are suitable for planting in Goucher land ? (Please select all that apply)	ગૌચર જમીનમાં વાલેતર માટે કયા પ્રકારના છોડના રોપા યોગ્ય છે? (કૃપા કરીને લાગુ પડતા તમામ વિકલ્પો પસંદ કરો)	
Please select all the names of the plants that can be planted in Goucher land .	કૃપા કરીને ગૌચર જમીનમાં વાલેતર કરી શકાય તેવા તમામ છોડના નામ પસંદ કરો.	
What safety measures do you believe are necessary for tree saplings?	તમે શું માનો છો કે વૃક્ષના રોપાઓ માટે સલામતીના કયા પગલાં જરૂરી છે?	
Kharaba Land - Section	ખરાબાની જમીન અંગેના પ્રશ્નો	
What is the approximate size of Kharaba Land (in acres) available for tree plantation in the village?	ગામમાં વૃક્ષારોપણ માટે ખરાબા જમીન (એકરમાં)ની અંદાજિત સાઈઝ (માપ) કેટલી છે?	
In which hamlets or areas are these Kharaba Land located?	આ ખરાબાની જમીન કયા ગામો અથવા વિસ્તારોમાં આવેલી છે?	

What is the estimated number of trees that can be planted on Kharaba Land in the village?	ગામમાં ખરાબાની જમીન પર વાવી શકાય તેવા વૃક્ષોની અંદાજિત સંખ્યા કેટલી છે?	
What water sources are accessible for watering saplings on Kharaba Land? (Please select all applicable)	ખરાબાની જમીન પરના છોડને પાણી આપવા માટે કયા પાણીના સ્ત્રોતો ઉપલબ્ધ છે? (કૃપા કરીને તમામ લાગુ પસંદ કરો)	
How many months of the year is water available in the Kharaba Land to irrigate the saplings?	ખરાબાની જમીનમાં રોપાઓને સિંચાઈ માટે વર્ષના કેટલા મહિનામાં પાણી મળે છે?	
During the summer months, is water availability sufficient to safeguard the saplings that will be planted in Kharaba Land ?	ઉનાળાના મહિનાઓ દરમિયાન, ખરાબાની જમીનમાં રોપવામાં આવનાર રોપાઓની સુરક્ષા માટે પાણીની ઉપલબ્ધતા પૂરતી છે?	
Who is responsible for the care and maintenance of saplings planted on Kharaba Land ?	ખરાબાની જમીન પર વાવેલા રોપાઓની સંભાળ અને જાળવણી માટે કોણ જવાબદાર છે?	
What types of plant saplings are suitable for planting in Kharaba Land ? (Please select all that apply)	ખરાબાની જમીનમાં વાવેતર માટે કયા પ્રકારના છોડના રોપા યોગ્ય છે? (કૃપા કરીને લાગુ પડતા તમામને પસંદ કરો)	
Please select all the names of the plants that can be planted in Kharaba Land	કૃપા કરીને ખરાબાની જમીનમાં વાવેતર કરી શકાય તેવા તમામ છોડના નામ પસંદ કરો	
What safety measures do you believe are necessary for tree saplings?	તમે શું માનો છો કે વૃક્ષના રોપાઓ માટે સલામતીના કયા પગલાં જરૂરી છે?	
Forest land - Section	જંગલની જમીન અંગેનાં પ્રશ્નો	
What is the approximate size of Forest land (in acres) available for tree plantation in the village?	ગામમાં વૃક્ષારોપણ માટે જંગલની જમીન (એકરમાં)ની અંદાજિત સાઈઝ (માપ) કેટલી છે?	
In which hamlets or areas are these Forest land located?	આ જંગલની જમીન કયા ગામો અથવા વિસ્તારોમાં આવેલી છે?	
What is the estimated number of trees that can be planted on Forest land in the village?	ગામમાં જંગલની જમીન પર વાવેતર કરી શકાય તેવા વૃક્ષોની અંદાજિત સંખ્યા કેટલી છે?	

What water sources are accessible for watering saplings on Forest land? (Please select all applicable)	જંગલની જમીન પરના છોડને પાણી આપવા માટે કયા જળ સ્ત્રોતો ઉપલબ્ધ છે? (કૃપા કરીને તમામ લાગુ પસંદ કરો)	
How many months of the year is water available in the Forest land to irrigate the saplings?	જંગલની જમીનમાં છોડને સિંચાઈ માટે વર્ષના કેટલા મહિના પાણી ઉપલબ્ધ હોય છે?	
During the summer months, is water availability sufficient to safeguard the saplings that will be planted in Forest land?	ઉનાળાના મહિનાઓ દરમિયાન, શું જંગલની જમીનમાં રોપવામાં આવનાર રોપાઓની સુરક્ષા માટે પાણીની ઉપલબ્ધતા પૂરતી છે?	
Who is responsible for the care and maintenance of saplings planted on Forest land?	જંગલની જમીન પર વાવેલા રોપાઓની સંભાળ અને જાળવણી માટે કોણ જવાબદાર છે?	
What types of plant saplings are suitable for planting in Forest land? (Please select all that apply)	જંગલની જમીનમાં વાવેતર માટે કયા પ્રકારના છોડના રોપા યોગ્ય છે? (કૃપા કરીને લાગુ પડતા તમામ વિકલ્પો પસંદ કરો)	
Please select all the names of the plants that can be planted in Forest land	કૃપા કરીને જંગલની જમીનમાં વાવેતર કરી શકાય તેવા તમામ છોડના નામ પસંદ કરો	
What safety measures do you believe are necessary for tree saplings?	તમે શું માનો છો કે વૃક્ષના રોપાઓ માટે સલામતીના કયા પગલાં જરૂરી છે?	
Temple land - Section	મંદિરની જમીન અંગેના પ્રશ્નો	
What is the approximate size of Temple land (in sq. meter) available for tree plantation in the village?	ગામમાં વૃક્ષારોપણ માટે મંદિરની જમીન (ચોરસ મીટરમાં) ની અંદાજિત સાઈઝ (માપ) કેટલી છે?	
In which hamlets or areas are these Temple land located?	આ મંદિરની જમીન કયા ગામો અથવા વિસ્તારોમાં આવેલી છે?	
What is the estimated number of trees that can be planted on Temple land in the village?	ગામમાં મંદિરની જમીન પર લગાવી શકાય તેવા વૃક્ષોની અંદાજિત સંખ્યા કેટલી છે?	

What water sources are accessible for watering saplings on Temple land ? (Please select all applicable)	મંદિરની જમીન પરના છોડને પાણી આપવા માટે કયા પાણીના સ્ત્રોતો ઉપલબ્ધ છે? (કૃપા કરીને તમામ લાગુ પડતાં વિકલ્પો પસંદ કરો)	
How many months of the year is water available in the Temple land to irrigate the saplings?	મંદિરની જમીનમાં રોપાઓને સિંચાઈ કરવા માટે વર્ષમાં કેટલા મહિના પાણી મળે છે?	
During the summer months, is water availability sufficient to safeguard the saplings that will be planted in Temple land?	ઉનાળાના મહિનાઓ દરમિયાન, શું મંદિરની જમીનમાં રોપવામાં આવનાર રોપાઓની સુરક્ષા માટે પાણીની ઉપલબ્ધતા પૂરતી છે?	
Who is responsible for the care and maintenance of saplings planted on Temple land?	મંદિરની જમીન પર વાવેલા રોપાઓની સંભાળ અને જાળવણી માટે કોણ જવાબદાર છે?	
What types of plant saplings are suitable for planting in Temple land? (Please select all that apply)	મંદિરની જમીનમાં રોપવા માટે કયા પ્રકારના છોડના રોપા યોગ્ય છે? (કૃપા કરીને લાગુ પડતા તમામ વિકલ્પો પસંદ કરો)	
Please select all the names of the plants that can be planted in Temple land	કૃપા કરીને મંદિરની જમીનમાં વાવેતર કરી શકાય તેવા તમામ છોડના નામ પસંદ કરો	
What safety measures do you believe are necessary for tree saplings?	તમે શું માનો છો કે વૃક્ષના રોપાઓ માટે સલામતીના કયા પગલાં જરૂરી છે?	
Panchayat land - Section	પંચાયત જમીન અંગેના પ્રશ્નો	
What is the approximate size of Panchayat land (in acres) available for tree plantation in the village?	ગામમાં વૃક્ષારોપણ માટે પંચાયતની જમીન (એકરમાં)ની અંદાજિત સાઈઝ (માપ) કેટલી છે?	
In which hamlets or areas are these Panchayat land located?	આ પંચાયતની જમીન કયા ગામો અથવા વિસ્તારોમાં આવેલી છે?	
What is the estimated number of trees that can be planted on Panchayat land in the village?	ગામમાં પંચાયતની જમીન પર વાવી શકાય તેવા વૃક્ષોની અંદાજિત સંખ્યા કેટલી છે?	
What water sources are accessible for watering saplings on Panchayat land? (Please select all applicable)	પંચાયતની જમીન પરના છોડને પાણી આપવા માટે કયા પાણીના સ્ત્રોતો ઉપલબ્ધ છે? (કૃપા કરીને તમામ લાગુ પડતાં વિકલ્પો પસંદ કરો)	

How many months of the year is water available in the Panchayat land to irrigate the saplings?	પંચાયતની જમીનમાં રોપાઓને સિંચાઈ માટે વર્ષના કેટલા મહિના પાણી મળે છે?	
During the summer months, is water availability sufficient to safeguard the saplings that will be planted in Panchayat land?	ઉનાળાના મહિનાઓ દરમિયાન, પંચાયતની જમીનમાં રોપવામાં આવનાર રોપાઓની સુરક્ષા માટે પાણીની ઉપલબ્ધતા પૂરતી છે?	
Who is responsible for the care and maintenance of saplings planted on Panchayat land?	પંચાયતની જમીન પર વાવેલા રોપાઓની સારસંભાળ અને જાળવણીની જવાબદારી કોની છે?	
What types of plant saplings are suitable for planting in Panchayat land? (Please select all that apply)	પંચાયતની જમીનમાં વાવેતર માટે કયા પ્રકારના છોડના રોપા યોગ્ય છે? (ફૂપા કરીને લાગુ પડતા તમામ વિકલ્પો પસંદ કરો)	
Please select all the names of the plants that can be planted in Panchayat land	ફૂપા કરીને પંચાયતની જમીનમાં વાવેતર કરી શકાય તેવા તમામ છોડના નામ પસંદ કરો	
What safety measures do you believe are necessary for tree saplings?	તમે શું માનો છો કે વૃક્ષના રોપાઓ માટે સલામતીના કયા પગલાં જરૂરી છે?	
Land around the Panchayat office - Section	પંચાયત કચેરીની આસપાસની જમીન અંગેનાં પ્રશ્નો	
What is the approximate size of land located around Panchayat (in sq. meter) available for tree plantation in the village?	ગામમાં વૃક્ષારોપણ માટે પંચાયતની આસપાસ (ચોરસ મીટરમાં) આવેલી જમીનની અંદાજિત સાઈઝ (માપ) કેટલી છે?	
In which hamlets or areas is this land around the Panchayat office located?	પંચાયત કચેરીની આજુબાજુની આ જમીન કયા ગામો અથવા વિસ્તારમાં આવેલી છે?	
What is the estimated number of trees that can be planted on land around the Panchayat office in the village?	ગામમાં પંચાયત કચેરીની આસપાસની જમીન પર વાવી શકાય તેવા વૃક્ષોની અંદાજિત સંખ્યા કેટલી છે?	

What water sources are accessible for watering saplings on land around the Panchayat office? (Please select all applicable)	પંચાયત કચેરીની આસપાસની જમીન પરના છોડને પાણી આપવા માટે કયા પાણીના સ્ત્રોતો ઉપલબ્ધ છે? (ફૂપા કરીને તમામ લાગુ પડતાં વિકલ્પો પસંદ કરો)	
How many months of the year is water available in the land around the Panchayat office to irrigate the saplings?	પંચાયત કચેરીની આજુબાજુની જમીનમાં રોપાઓને સિંચાઈ કરવા માટે વર્ષમાં કેટલા મહિના પાણી મળે છે?	
During the summer months, is water availability sufficient to safeguard the saplings that will be planted in land around the Panchayat office?	ઉનાળાના મહિનાઓ દરમિયાન, પંચાયત કચેરીની આજુબાજુની જમીનમાં રોપવામાં આવતા રોપાઓની સુરક્ષા માટે પાણીની ઉપલબ્ધતા પૂરતી છે?	
Who is responsible for the care and maintenance of saplings planted on land around the Panchayat office?	પંચાયત કચેરીની આજુબાજુની જમીનમાં રોપાયેલા રોપાઓની સારસંભાળ અને જાળવણીની જવાબદારી કોની છે?	
What types of plant saplings are suitable for planting in land around the Panchayat office? (Please select all that apply)	પંચાયત કચેરીની આજુબાજુની જમીનમાં કયા પ્રકારના છોડ રોપવા યોગ્ય છે? (ફૂપા કરીને લાગુ પડતા તમામ વિકલ્પો પસંદ કરો)	
Please select all the names of the plants that can be planted in land around the Panchayat office .	ફૂપા કરીને પંચાયત કચેરીની આસપાસની જમીનમાં વાવેતર કરી શકાય તેવા તમામ છોડના નામ પસંદ કરો.	
What safety measures do you believe are necessary for tree saplings?	તમે શું માનો છો કે વૃક્ષના રોપાઓ માટે સલામતીના કયા પગલાં જરૂરી છે?	
school land - Section	શાળાની જમીન અંગના પ્રશ્નો	
What is the approximate size of the school land (in sq. meter) available for tree plantation in the village?	ગામમાં વૃક્ષારોપણ માટે શાળાની જમીન (ચોરસ મીટરમાં)ની અંદાજિત સાઈઝ (માપ) કેટલી છે?	
In which hamlets or areas are these school lands located?	આ શાળાની જમીનો કયા ગામો અથવા વિસ્તારોમાં આવેલી છે?	

What is the estimated number of trees that can be planted on the school lands in the village?	ગામમાં શાળાની જમીનો પર વાવી શકાય તેવા વૃક્ષોની અંદાજિત સંખ્યા કેટલી છે?	
What water sources are accessible for watering saplings on school lands ? (Please select all applicable)	શાળાની જમીન પરના છોડને પાણી આપવા માટે કયા પાણીના સ્ત્રોતો ઉપલબ્ધ છે? (કૃપા કરીને તમામ લાગુ પડતાં વિકલ્પો પસંદ કરો)	
How many months of the year is water available in the school lands to irrigate the saplings?	શાળાની જમીનોમાં વર્ષના કેટલા મહિનામાં રોપાઓને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ હોય છે?	
During the summer months, is water availability sufficient to safeguard the saplings that will be planted in school lands ?	ઉનાળાના મહિનાઓ દરમિયાન, શું શાળાની જમીનમાં રોપવામાં આવનાર રોપાઓને સુરક્ષિત રાખવા માટે પાણીની ઉપલબ્ધતા પૂરતી છે?	
Who is responsible for the care and maintenance of saplings planted on school lands ?	શાળાની જમીન પર વાવેલ રોપાઓની સંભાળ અને જાળવણી માટે કોણ જવાબદાર છે?	
What types of plant saplings are suitable for planting in school lands ? (Please select all that apply)	શાળાની જમીનમાં રોપવા માટે કયા પ્રકારના છોડના રોપા યોગ્ય છે? (કૃપા કરીને લાગુ પડતા તમામ વિકલ્પો પસંદ કરો)	
Please select all the names of the plants that can be planted in school lands .	કૃપા કરીને શાળાની જમીનમાં વાવેતર કરી શકાય તેવા તમામ છોડના નામ પસંદ કરો.	
What safety measures do you believe are necessary for tree saplings?	તમે શું માનો છો કે વૃક્ષના રોપાઓ માટે સલામતીના કયા પગલાં જરૂરી છે?	
Anganwadi land - Section	આંગણવાડીની જમીન અંગેના પ્રશ્નો	
What is the approximate size of Anganwadi (in sq. meter) available for tree plantation in the village?	ગામમાં વૃક્ષારોપણ માટે આંગણવાડી (ચોરસ મીટરમાં)ની અંદાજિત સાઈઝ (માપ) કેટલી છે?	
In which hamlets or areas are these Anganwadi land located?	આ આંગણવાડીની જમીન કયા ગામો અથવા વિસ્તારોમાં આવેલી છે?	
What is the estimated number of trees that can be planted on Anganwadi land in the village?	ગામમાં આંગણવાડીની જમીન પર વાવી શકાય તેવા વૃક્ષોની અંદાજિત સંખ્યા કેટલી છે?	

What water sources are accessible for watering saplings on Anganwadi land? (Please select all applicable)	આંગણવાડી જમીન પરના છોડને પાણી આપવા માટે કયા પાણીના સ્ત્રોતો ઉપલબ્ધ છે? (કૃપા કરીને તમામ લાગુ પડતાં વિકલ્પો પસંદ કરો)	
How many months of the year is water available in the Anganwadi land to irrigate the saplings?	આંગણવાડીની જમીનમાં છોડને સિંચાઈ કરવા માટે વર્ષમાં કેટલા મહિના પાણી મળે છે?	
During the summer months, is water availability sufficient to safeguard the saplings that will be planted in Anganwadi land?	ઉનાળાના મહિનાઓ દરમિયાન, શું આંગણવાડીની જમીનમાં રોપવામાં આવનાર રોપાઓની સુરક્ષા માટે પાણીની ઉપલબ્ધતા પૂરતી છે?	
Who is responsible for the care and maintenance of saplings planted on Anganwadi land?	આંગણવાડીની જમીન પર રોપવામાં આવેલ રોપાઓની સંભાળ અને જાળવણી માટે કોની જવાબદારી છે?	
What types of plant saplings are suitable for planting in Anganwadi land? (Please select all that apply)	આંગણવાડીની જમીનમાં રોપવા માટે કયા પ્રકારના છોડના રોપા યોગ્ય છે? (કૃપા કરીને લાગુ પડતા તમામને પસંદ કરો)	
Please select all the names of the plants that can be planted in Anganwadi land.	કૃપા કરીને આંગણવાડીની જમીનમાં વાવેતર કરી શકાય તેવા તમામ છોડના નામ પસંદ કરો.	
What safety measures do you believe are necessary for tree saplings?	તમે શું માનો છો કે વૃક્ષના રોપાઓ માટે સલામતીના કયા પગલાં જરૂરી છે?	
Primary Health Centre land - Section	પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જમીન અંગેનાં પ્રશ્નો	
What is the approximate size of Primary Health Centre land (in sq. meter) available for tree plantation in the village?	ગામમાં વૃક્ષારોપણ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જમીન (ચોરસ મીટરમાં)ની અંદાજિત સાઈઝ (માપ) કેટલી છે?	
In which hamlets or areas are these Primary Health Centre land located?	આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જમીન કયા ગામો અથવા વિસ્તારોમાં આવેલી છે?	
What is the estimated number of trees that can be planted on Primary Health Centre land in the village?	ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જમીન પર વાવેતર કરી શકાય તેવા વૃક્ષોની અંદાજિત સંખ્યા કેટલી છે?	

What water sources are accessible for watering saplings on Primary Health Centre land? (Please select all applicable)	પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જમીન પરના છોડને પાણી આપવા માટે કયા પાણીના સ્ત્રોતો ઉપલબ્ધ છે? (કૃપા કરીને તમામ લાગુ પડતાં વિકલ્પ પસંદ કરો)	
How many months of the year is water available in the Primary Health Centre land to irrigate the saplings?	પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જમીનમાં વર્ષના કેટલા મહિનામાં રોપાઓને સિંચાઈ માટે પાણી મળે છે?	
During the summer months, is water availability sufficient to safeguard the saplings that will be planted in Primary Health Centre land?	ઉનાળાના મહિનાઓ દરમિયાન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જમીનમાં રોપવામાં આવનાર રોપાઓની સુરક્ષા માટે પાણીની ઉપલબ્ધતા પૂરતી છે?	
Who is responsible for the care and maintenance of saplings planted on Primary Health Centre land?	પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જમીન પર વાવેલા રોપાઓની સંભાળ અને જાળવણીની જવાબદારી કોની છે?	
What types of plant saplings are suitable for planting in Primary Health Centre land? (Please select all that apply)	પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જમીનમાં કયા પ્રકારના છોડ રોપવા માટે યોગ્ય છે? (કૃપા કરીને લાગુ પડતા તમામ વિકલ્પો પસંદ કરો)	
Please select all the names of the plants that can be planted in Primary Health Centre land	પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જમીનમાં વાવેતર કરી શકાય તેવા તમામ છોડના નામ કૃપા કરીને પસંદ કરો	
What safety measures do you believe are necessary for tree saplings?	તમે શું માનો છો કે વૃક્ષના રોપાઓ માટે સલામતીના કયા પગલાં જરૂરી છે?	
Graveyard Land Section	કબ્રસ્તાનની જમીન અંગેનાં પ્રશ્નો	
What is the approximate size of Graveyard (in sq. meter) available for tree plantation in the village?	ગામમાં વૃક્ષારોપણ માટે કબ્રસ્તાનની જમીન (ચોરસ મીટરમાં)ની અંદાજિત સાઈઝ (માપ) કેટલી છે?	
In which hamlets or areas are these Graveyard land located?	આ કબ્રસ્તાનની જમીન કયા ગામો અથવા વિસ્તારોમાં આવેલી છે?	
What is the estimated number of trees that can be planted on Graveyard land in the village?	ગામમાં કબ્રસ્તાનની જમીન પર વાવેતર કરી શકાય તેવા વૃક્ષોની અંદાજિત સંખ્યા કેટલી છે?	

What water sources are accessible for watering saplings on Graveyard land? (Please select all applicable)	કબ્રસ્તાનની જમીન પરના છોડને પાણી આપવા માટે કયા પાણીના સ્ત્રોતો ઉપલબ્ધ છે? (કૃપા કરીને તમામ લાગુ પડતાં વિકલ્પ પસંદ કરો)	
How many months of the year is water available in the Graveyard land to irrigate the saplings?	કબ્રસ્તાનની જમીનમાં વર્ષના કેટલા મહિનામાં રોપાઓને સિંચાઈ માટે પાણી મળે છે?	
During the summer months, is water availability sufficient to safeguard the saplings that will be planted in Graveyard land?	ઉનાળાના મહિનાઓ દરમિયાન, કબ્રસ્તાનની જમીનમાં રોપવામાં આવનાર રોપાઓની સુરક્ષા માટે પાણીની ઉપલબ્ધતા પૂરતી છે?	
Who is responsible for the care and maintenance of saplings planted on Graveyard land?	કબ્રસ્તાનની જમીન પર વાવેલા રોપાઓની સંભાળ અને જાળવણીની જવાબદારી કોની છે?	
What types of plant saplings are suitable for planting in Graveyard land? (Please select all that apply)	કબ્રસ્તાનની જમીનમાં કયા પ્રકારના છોડ રોપવા માટે યોગ્ય છે? (કૃપા કરીને લાગુ પડતા તમામ વિકલ્પો પસંદ કરો)	
Please select all the names of the plants that can be planted in Graveyard land	કબ્રસ્તાનની જમીનમાં વાવેતર કરી શકાય તેવા તમામ છોડના નામ કૃપા કરીને પસંદ કરો	
What safety measures do you believe are necessary for tree saplings?	તમે શું માનો છો કે વૃક્ષના રોપાઓ માટે સલામતીના કયા પગલાં જરૂરી છે?	
Crematorium Land Section	સ્મશાનની જમીન અંગેનાં પ્રશ્નો	
What is the approximate size of Crematorium land (in sq. meter) available for tree plantation in the village?	ગામમાં વૃક્ષારોપણ માટે સ્મશાનની જમીન (ચોરસ મીટરમાં)ની અંદાજિત સાઈઝ (માપ) કેટલી છે?	
In which hamlets or areas are these Crematorium land located?	આ સ્મશાનની જમીન કયા ગામો અથવા વિસ્તારોમાં આવેલી છે?	
What is the estimated number of trees that can be planted on Crematorium land in the village?	ગામમાં સ્મશાનની જમીન પર વાવેતર કરી શકાય તેવા વૃક્ષોની અંદાજિત સંખ્યા કેટલી છે?	

What water sources are accessible for watering saplings on Crematorium land? (Please select all applicable)	સ્મશાનની જમીન પરના છોડને પાણી આપવા માટે કયા પાણીના સ્ત્રોતો ઉપલબ્ધ છે? (કૃપા કરીને તમામ લાગુ પડતાં વિકલ્પ પસંદ કરો)	
How many months of the year is water available in the Crematorium land to irrigate the saplings?	સ્મશાનની જમીનમાં વર્ષના કેટલા મહિનામાં રોપાઓને સિંચાઈ માટે પાણી મળે છે?	
During the summer months, is water availability sufficient to safeguard the saplings that will be planted in Crematorium land?	ઉનાળાના મહિનાઓ દરમિયાન, સ્મશાનની જમીનમાં રોપવામાં આવનાર રોપાઓની સુરક્ષા માટે પાણીની ઉપલબ્ધતા પૂરતી છે?	
Who is responsible for the care and maintenance of saplings planted on Crematorium land?	સ્મશાનની જમીન પર વાવેલા રોપાઓની સંભાળ અને જાળવણીની જવાબદારી કોની છે?	
What types of plant saplings are suitable for planting in Crematorium land? (Please select all that apply)	સ્મશાનની જમીનમાં કયા પ્રકારના છોડ રોપવા માટે યોગ્ય છે? (કૃપા કરીને લાગુ પડતા તમામ વિકલ્પો પસંદ કરો)	
Please select all the names of the plants that can be planted in Crematorium land	સ્મશાનની જમીનમાં વાવેતર કરી શકાય તેવા તમામ છોડના નામ કૃપા કરીને પસંદ કરો	
What safety measures do you believe are necessary for tree saplings?	તમે શું માનો છો કે વૃક્ષના રોપાઓ માટે સલામતીના કયા પગલાં જરૂરી છે?	
other public land - Section	અન્ય જાહેર જમીન અંગેનાં પ્રશ્નો	
What is the approximate size of other public land (in acres) available for tree plantation in the village?	ગામમાં વૃક્ષારોપણ માટે ઉપલબ્ધ અન્ય જાહેર જમીન (એકરમાં)ની અંદાજિત સાઈઝ (માપ) કેટલી છે?	
In which hamlets or areas are these other public land located?	આ અન્ય જાહેર જમીનો કયા ગામો અથવા વિસ્તારોમાં આવેલી છે?	
What is the estimated number of trees that can be planted on other public land in the village?	ગામની અન્ય જાહેર જમીન પર વાવી શકાય તેવા વૃક્ષોની અંદાજિત સંખ્યા કેટલી છે?	

What water sources are accessible for watering saplings on other public land ? (Please select all applicable)	અન્ય જાહેર જમીન પરના છોડને પાણી આપવા માટે કયા જળ સ્ત્રોતો ઉપલબ્ધ છે? (ફૂપા કરીને તમામ લાગુ પડતાં વિકલ્પો પસંદ કરો)	
How many months of the year is water available in the other public land to irrigate the saplings?	અન્ય જાહેર જમીનમાં છોડને સિંચાઈ માટે વર્ષના કેટલા મહિના પાણી મળે છે?	
During the summer months, is water availability sufficient to safeguard the saplings that will be planted in other public land ?	ઉનાળાના મહિનાઓ દરમિયાન, શું અન્ય જાહેર જમીનમાં રોપવામાં આવનાર રોપાઓની સુરક્ષા માટે પાણીની ઉપલબ્ધતા પૂરતી છે?	
Who is responsible for the care and maintenance of saplings planted on other public land ?	અન્ય જાહેર જમીન પર વાવેલા રોપાઓની સંભાળ અને જાળવણી માટે કોણ જવાબદાર છે?	
What types of plant saplings are suitable for planting in other public land ? (Please select all that apply)	અન્ય જાહેર જમીનમાં રોપવા માટે કયા પ્રકારના છોડના રોપા યોગ્ય છે? (ફૂપા કરીને લાગુ પડતા તમામ વિકલ્પો પસંદ કરો)	
Please select all the names of the plants that can be planted in other public land .	ફૂપા કરીને અન્ય જાહેર જમીનમાં વાવેતર કરી શકાય તેવા તમામ છોડના નામ પસંદ કરો.	
What safety measures do you believe are necessary for tree saplings?	તમે શું માનો છો કે વૃક્ષના રોપાઓ માટે સલામતીના કયા પગલાં જરૂરી છે?	
Coast /Shoreline - Section	કાંઠા/દરિયા કિનારા અંગેનાં પ્રશ્નો	
What is the approximate size of Coast /Shoreline land (in sq. meter) available for tree plantation in the village?	ગામમાં વૃક્ષારોપણ માટે કિનારા/કિનારાની જમીન (ચોરસ મીટરમાં)ની અંદાજિત સાઈઝ (માપ) કેટલી છે?	
In which hamlets or areas are these Coast /Shoreline located?	આ કાંઠા/દરિયા કિનારા કયા ગામો અથવા વિસ્તારોમાં સ્થિત છે?	
What is the estimated number of trees that can be planted on Coast /Shoreline in the village?	ગામમાં દરિયાકિનારે/કિનારા પર વાવી શકાય તેવા વૃક્ષોની અંદાજિત સંખ્યા કેટલી છે?	

What water sources are accessible for watering saplings on Coast /Shoreline ? (Please select all applicable)	દરિયાકાંઠે/કિનારા પરના રોપાઓને પાણી આપવા માટે કયા જળ સ્ત્રોતો ઉપલબ્ધ છે? (ફૂપા કરીને તમામ લાગુ પડતાં વિકલ્પો પસંદ કરો)	
How many months of the year is water available in the Coast /Shoreline to irrigate the saplings?	દરિયા કિનારે/તટરેખામાં વર્ષના કેટલા મહિનામાં છોડને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ હોય છે?	
During the summer months, is water availability sufficient to safeguard the saplings that will be planted inCoast /Shoreline ?	ઉનાળાના મહિનાઓ દરમિયાન, દરિયાકિનારે/તટરેખામાં રોપવામાં આવનાર રોપાઓની સુરક્ષા માટે પાણીની ઉપલબ્ધતા પૂરતી છે?	
Who is responsible for the care and maintenance of saplings planted on Coast /Shoreline?	દરિયાકાંઠે/કિનારા પર વાવેલા રોપાઓની સંભાળ અને જાળવણી માટે કોણ જવાબદાર છે?	
What types of plant saplings are suitable for planting in Coast /Shoreline? (Please select all that apply)	કાંઠા/દરિયા કિનારે કયા પ્રકારના છોડ રોપવા માટે યોગ્ય છે? (ફૂપા કરીને લાગુ પડતા તમામ વિકલ્પો પસંદ કરો)	
Please select all the names of the plants that can be planted in Coast /Shoreline	ફૂપા કરીને કાંઠા/દરિયા કિનારે વાવેતર કરી શકાય તેવા તમામ છોડના નામ પસંદ કરો	
What safety measures do you believe are necessary for tree saplings?	તમે શું માનો છો કે વૃક્ષના રોપાઓ માટે સલામતીના કયા પગલાં જરૂરી છે?	
Is there a nursery in the village?	શું ગામમાં નર્સરી છે?	
If not, where will you get the trees from (name of nursery and village)	જો નહીં, તો તમને વૃક્ષો ક્યાંથી મળશે (નર્સરી અને ગામનું નામ)	
Do the women ready to develop the nursery in the village?	શું મહિલાઓ ગામમાં નર્સરી વિકસાવવા તૈયાર છે?	
Names of women who are ready to develop a nursery.	નર્સરી વિકસાવવા તૈયાર હોય તેવી મહિલાઓના નામ.	
Data entered by	જેમનાં દ્વારા ડેટા દાખલ કરેલ છે તેમનું નામ	
Date of the form submission	ફોર્મ સબમિટ કરવાની તારીખ	